



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૦/૦૮/૨૦૧૯ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૪૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૦ કેસ કરી, ૨૬ વ્યક્તિઓને ઝડપી, ૨૬૫ લીટર દેશી દારૂ, ૫૯ બોટલ ઈંગ્લીશ દારૂ, ૪૬ ક્વોટર ઈંગ્લીશ દારૂ, ૦૧ મોટર સાયકલ અને ૦૨ સ્કુટર કબજે કર્યા હતા. તેમજ જુગારધારા હેઠળ ૦૩ કેસ કરી, ૦૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૮,૩૨૫/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૪૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૭૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ ૦૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૩૪૮/૧૯

આનંદનગર : દીવ્યાબહેન વા/ઓ અભીષેકભાઈ મંડોવરા (ઉ.વ.૩૩)(રહે.પુષ્પક એપાર્ટમેન્ટ પ્રેરણાતીર્થ રોડ સેટેલાઈટ) એ તા.૦૮/૦૮/૨૦૧૯ નારોજ આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે એપ્રિલ/૨૦૧૮ થી મે/૨૦૧૯ સુધીના સમયગાળા દરમિયાન પોતાના ઘરે આરોપી (૧) મુકેશ કેલાશચંદ્ર મુદસા (૨) ચંદ્રકાંતા વા/ઓ કેલાશચંદ્ર મુદસા (૩) મધુબાલા વા/ઓ મુકેશ મુદસા(૪) શોભીત ચંદ્રકાંતા મુદસા (તમામ રહે. ગામ-નિમ્બાઈડા, ડાક બંગ્લા રોડ, મીનાક્ષી બસ સ્ટેન્ડ પાસે શાસ્ત્રી કોલોની તા-નિમ્બાઈડા જી-ચીતોડાગઢ (રાજસ્થાન) અને (૫) રાજેન્દ્ર ટોયટાની ફર્મ ગાડીનો ડીલર ઓટો ગોયનકા ઓટો સેલ્સ પ્રા.લી ઉદેપુર માદડિ છોટા ઉદેપુર) નાઓએ ભેગામળી દિવ્યાબહેન ને “રાજસ્થાન લાફર્જ સીમેન્ટની કંપનીમાં ફોર વ્હીલર ગાડી મુકશો તો નફો થશે” તેવી વાત કરી વિશ્વાસમાં લઈ, દિવ્યાબહેન પાસેથી રૂપિયા ૮,૬૦,૦૦૦/- ગોયનકા ઓટો સેલ્સમાં પ્રા.લી.ના ખાતામાં ભરાવી, ગાડી તેમજ આપેલ રૂપિયા પરત નહીં આપી દિવ્યાબહેન સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.આર.ઝરૂ ચલાવે છે.

નવરંગપુરા : પિયુષભાઈ કાળુભાઈ પટેલ (ઉ.વ.૩૯)(રહે.સુયોગ એપાર્ટમેન્ટ જેબર સ્કુલ પાસે થલતેજ) એ તા.૦૮/૦૮/૨૦૧૯ નારોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૯/૯/૨૦૧૫ થી આજદીન સુધીના સમયગાળા દરમિયાન આશ્રમ રોડ નહેરૂબ્રીજ કોર્નર સાકાર-૭ ખાતે આરોપી જીજ્ઞેશભાઈ રામજીભાઈ પટેલ (રહે.સત્યમેવ વિસ્તા ગોતા ફલાય ઓવરબ્રીજ નજીક ગોતા સરખેજ ગાંધીનગર હાઇવે) એ પિયુષભાઈ સાથે લોભામણી વાતો કરી વિશ્વાસમાં લઈ, પિયુષભાઈ પાસેથી કેમિકલનો માલ ઉધારમાં ખરીદ કરી, અલગ-અલગ બીલો ના કુલ રૂપિયા ૨૨,૭૪,૭૨૬/- આજદીન સુધી નહીં ચુકવી, પિયુષભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એ.પરમાર ચલાવે છે.

ધરફોડ :-

સમાચાર યાદી નં.૧૩૪૯/૧૯

સરખેજ : યાસીનભાઇ તાજમોહંમદ શેખ (ઉ.વ.૪૪)(રહે.મકરબા રોજા પાસે, ઘુમટી પાસે ચાલીમાં, મકરબા) એ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૦૮/૨૦૧૯ ના કલાક ૦૦/૦૦ થી ૫/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી, લાકડાની તીજોરીમાંથી એક સોનાની વિંટી કિંમત રૂપિયા ૨,૫૦૦/-, સોનાની કાનની કડી કિંમત રૂપિયા ૨,૫૦૦/-, સોનાની નાકની ચુની કિંમત રૂપિયા ૨,૫૦૦/- અને રોકડ રૂપિયા ૧,૬૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૭૨,૫૦૦/- મતાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.આર.ચૌધરી ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૩૫૦/૧૯

સાબરમતી : અશોકભાઇ મણીલાલ મકવાણા (ઉ.વ.૪૨)(રહે.ચંદ્રભાગા છાપરા જવાહરચોક સાબરમતી) એ અગમ્ય કારણસર તા.૦૯/૦૮/૨૦૧૯ ના કલાક ૭/૦૦ વાગ્યાના સુમારે બોરડીના ઝાડની ડાળી સાથે દોરી બાંધી ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી રમણજી રામાજી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.